

Khudamat Shree Meher Baba.
 vgeia vira aiaia! na zai zis zozan
 a zai uz vira (vira) aia. ad vira! vira
 vira uz aiaia.

Mam

amir uz vira zai vira
 za ma { z z z z } { z z } { z z }
 za ma vira aia zai. au ma
hail uz vira vira vira ma uz
 uz zai. ma zai zai ma aia
 zai aia aia! ~~z z z z~~. ad vira!
 zai na—chance vira. za
 vira vira aia zai! zai zai zai
 vira aia ——— vira
 vira

M. ma zai vira vira.
Byram

27. 7.27.

765. Butler Moha
 Dastur Meher Road
 Camp Pora

Khudawand [Zoroastrian praise of God] Shri Meher Baba.

Please read this for God's sake! Here I don't know what to do and can't pay attention to anything. Shri Baba! Do not turn away from me.

How much love I have for you and what I think of you only I know and you too also must know. There you wanted to know what I wished for and I told you all. Shri Baba! Please give me a chance. And for God's sake, don't keep me lingering. Definitely write me a letter or else -- you know everything.

Your ever obedient
Byram [Beheram]

27.7.27.

765 Butler Mohalla
Dastoor Meher Rd
Camp Poona

765. Buthi Molha
Camp Pna.
22.12,

Khandanand Shree Meherbaba

જન દીઠ હારા ગમન જરા
ડીક છે, અને ગઈકાં બુધવારના
સંકરે જોડેકરાન બુધવારે રીડે રીડે,
અને જોડેકરાન રૂડે અને રૂખાર
પાસે આવેલા, સંકરે રૂડે રૂડે
જ્યારે ત્યજે કંદેરા આરે હારગામ
બોધકને ને સંકરે રૂડે રૂડે રૂડે
રૂડે આવેલા.

— નાં હાથે રૂડે રૂડે
રૂડે નામ રૂડે નામ નામ રૂડે
અને નામ નામ રૂડે રૂડે રૂડે
આદા! હી નામ! રૂડે રૂડે
બધુ નામ નામ રૂડે —————
રૂડે રૂડે રૂડે —

બધુ રૂડે રૂડે? સુધે પંડાને
નમસ્કાર રૂડે નામ રૂડે રૂડે
ગરામ નામ રૂડે સુધે ગરામ રૂડે
રૂડે રૂડે રૂડે. જરૂર જરામ નામ
ને રૂડે રૂડે રૂડે રૂડે.

મ. નામ રૂડે નામ રૂડે. S.
Byram.

765. Butler Mohalla
Camp Poona.
22.9.27.

Khudawand [Zoroastrian praise of God] Shree Meherbaba


At present my health is a little better. From yesterday (Wednesday), the doctor has started giving me injections. And after the injections are over I will come to you. The doctor has said that "you should go out of town when I say" when he tells me, I will come immediately.

-- You write that I showed my unwillingness to stay there [with you]so I am suffering because of that! Ah! Shri Baba! What should I write, you know everything

At present I -

What more to write. Convey my namaskars to all the Mandali and you accept the prostrations of this poor suffering self. Definitely write a reply and satisfy me.

Your ever obedient S
Byram [Beheram]



Mand

Camp Purna.

Dated 1 Mar 1929

પ્રજ્ઞાપતિ ~~જી. મામા~~ જી. મામા.

જન સાર રહે છે સદા સહાન પુત્ર સખા પુત્ર,
 - એ તમારા હૃદયમાં પ્રજ્ઞા છે કેરો રહેશે.
 જી મામા! તમા હવે સમુદ્ર ~~કેરો રહેશે~~ પુત્ર રહેશે
 કેરો કેરો તો ઇતિ સાર રીત માટે મિત્ર બંધને
 રહેશે; કેરો સમજ પડતી નથી - ને સુખ પડતું નથી,
 તમારા મહેર નકર રીતે તો બધું સારું
 વચ્ચે બેજાન દરમિયાન કે મામા સમય મુંબઈ
 કે બાબતમા મામા જાનો છું. રીત મામા તમારો
 તેમજ નરો ગરમ સામા કેરો,
 બધું મામા જેવું કેરો નથી.
 પ્રજ્ઞા ગરમ નરુવા સાધારે નપરકાર સમા કેરો નથી.
 સદા કેરો નથી રીત બેમા કેરો.

જી. તમારો સહન મામાદાર.

બેરમ

Replied
4-3-29

Camp Poona
Dated 1 Mar 1929

Respected and pure Shri Baba,

Today I reached Poona safe and sound and I will continue to do as per your orders.

Shri Baba! You tell me to always remain happy; in spite of that my mind is still restless these days; I cannot understand anything and I do not know what to do. If your compassionate Nazar is there [on me], all will turn out well. In 2-3 days time, I am going with Mother to Bombay to Dr. Billimoria. At present my health is neither good nor bad.

There is nothing else to write.

Please accept the prostrations of my poor self. I am awaiting your letter here.

Your ever obedient
Byram[Beheram]



~~Mam~~

Camp ~~3rd~~ Poona

Dated 3rd March 1929.

Dear Vishnu.

I hope you are quite well - there,

How is Shree Baba? Please write to me, I am very anxious about it.

Please tell Changi to send my "gayan" book for I am very badly in need of it.

Nothing to write anymore.

Waiting for your letter.

My salams to Buwasahib, Changi, Jal, Chagan, Sidhu, Billi, Pesu & all!

yours affectionately

Behnan.

Letter to Vishnu
Camp Poona
Dated 3 March 1929

Dear Vishnu.

I hope you are quite well there. How is Shree Baba? Please write it to me, I am very anxious about it.

Please tell Chanji to send my "gayan" book for I am badly in need of it.

Nothing to write anymore.

Waiting for your letter.

My sallams to Buwa Sahib, Chanji, Jal, Chagan, Sidhu, Billi, Pesu and all! (?)

Yours affectionately
Beheram.

POST

WRITING SPACE

INDIA



To.

Shree Meherbaba

c/o N. Sattha esqr

Akbar Cotton Press

Ahmednagar

THE ANNEXED CARD IS INTENDED
FOR THE ANSWER.

Hand

3rd March 1929

યુગ્મ પાંચ લી બાબત.

જાન હાલ મારા મનમાં

જરાઈ છે, પરાંત બાબતો કુમારો
સાચું છે. ગઈ રાત્રી ને મને સ્પષ્ટ
આજ મને મરે કાંઈ જાણ્યું હતું
- ને મરે રહે.

મરે મારા જીવ બાંધે બંધે
રહે છે. આજ રાત્રી મને
બાંધે બંધે જાણ્યું હતું.

મારું જાણ કાંઈ જાણ્યું રહે
સાચું આજ રાત્રી
રહે જાણ્યું જાણ્યું રહે રાત્રી
જાણ.

જુદા મારા જાણ્યું રાત્રી રાત્રી
માન રાત્રી રાત્રી રાત્રી
મા. જાણ્યું રાત્રી રાત્રી રાત્રી
ખરેખર

3rd March 1929

Worshipful and Pure Shri Baba,

At present my health is a little better but the pain in my chest continues. I hope you have received the letter I wrote to you, Shri, yesterday and also to Jal.

My mind still is very restless. I am very anxious to know the details [of what is happening] there. I am hoping that brother Jal will continue to write.

At present there is nothing else to write.

Please accept the prostrations of my poor self.

Your ever-obedient
Byram [Beheram]

POST

WRITING SPACE

INDIA



Shree Meherbaba
C/o W. Sattha esqr
Akbar cotton Press
Ahmednagar

~~Hand~~
ਪ੍ਰਭੂ ਪ੍ਰਦੇਸ਼ ਦੀ ਯਾਦ

4.9.29

ਜਨ ਮਨੋ ਏਕਸੇ
ਨਾ ਗਏ ਤੇ ਮੇਰੇ ਮਨੇ ਦੀ ਪਰ
ਤਿਆਰ ਹੋਵੇ ਪਰੰਤੂ ਤੇਰੇ ਮਨ
ਦੇ ਮੇਰੇ ਤੇਰੇ ਦੁਆਰੇ ਲੇਖੇ

ਧੂ.

ਮੇਰੇ ਮਨੇ ਦੇ ਮੇਰੇ ਮਨੇ
ਤੇਰੇ ਮਨੇ ਦੇ ਮੇਰੇ ਮਨੇ
ਤੇਰੇ ਮਨੇ ਦੇ ਮੇਰੇ ਮਨੇ

ਤੇਰੇ ਮਨੇ ਦੇ ਮੇਰੇ ਮਨੇ
ਤੇਰੇ ਮਨੇ ਦੇ ਮੇਰੇ ਮਨੇ

ਤੇਰੇ ਮਨੇ ਦੇ ਮੇਰੇ ਮਨੇ
ਤੇਰੇ ਮਨੇ ਦੇ ਮੇਰੇ ਮਨੇ

ਤੇਰੇ ਮਨੇ ਦੇ ਮੇਰੇ ਮਨੇ
ਤੇਰੇ ਮਨੇ ਦੇ ਮੇਰੇ ਮਨੇ
ਤੇਰੇ ਮਨੇ ਦੇ ਮੇਰੇ ਮਨੇ

5.3.29

Respected, Pure Shri Baba,

Yesterday and the day before I wrote letters to you, Shri, but have not received any reply. I am very anxiously waiting here.

My health is a little better at present. After 2-3 days I will go to Bombay and return.

Please continue to keep your compassionate Nazar on my poor self.

At present there is nothing else to write.

Please accept the prostrations of my poor self.

Your ever obedient
Byram [Beheram]

dt 23/dec 1929
765 Butla Malha

પુજ્ય પવિત્ર શ્રી બાબા,

Munshi

જા ગઈ પરો દીપસુ સોના સહી સહીતી રહી પુત્રો
આવી પુત્રી, મેં કાંઈ દાન જાગત જાવાને સમજાવી,
ગઈ કોઈ સમયે માય ભોલી ગયા ફાં અને બપોરે
પાછા ફર્યા બાદ મને કહ્યો ભાગા, "બેરામ, આજ
એકે કાગજ નું બાબા પર લખ્યું, લખ્યું ને માનને
દાનું સમજાવ્યું, તેના સમયે કહ્યું કે મેં બાબા
સમયે પર કાગજ લખ્યો કે બાગાજી સામવા કે
~~બેરામ~~ કીમત ^{જાગ} કાગ પર કહ્યું ને સમયે મને
૧ મી તારાને લખો તરફ મોકલો."

આ કાગજ મેં ફક્ત તારા બાગા સાફે લખ્યું છે,
સામવા સમયે બાદ મને સમજા સરહી પડે છે, બાકી
બધું કીડ સામવા કહે છે.

ફુલા ફરા જૂર કાગજ ના બાગા લખ્યો.
અને ૧ મી કે તમે તરફ ફુ સામવા.

પુજ્ય ગરામ પર મહેર નજર સામવા,
સામવાગ વખરફાર.

ભ. તારા સમયે તાબેદાર

બેરામ.

જૂર કાગજ લખ્યો

Dt 23-Dec-1929
765, Butler Mohalla
Respected and Pure Shri Baba,

Day before yesterday we reached Poona safe and sound. I explained some of the details to Father. Yesterday morning, Mother had been to Loni and on returning in the afternoon, she told me "Beheram, you write a letter to Baba today and write 'I have explained a lot to Mother so she says that if Baba writes a letter to her and agrees to keep Beheram only for the film work, then she will send me to your side on the 1st.'"

I am writing this letter just for your information. After returning from there I have had a severe cold. Everything else [that was ailing me] recovering completely.

Please kindly write a reply to this letter and I will come to your side on the 1st.

Keep your compassionate Nazar on my poor self.

Sakstang Namaskar [Salutations in prostration at your feet]

Your ever-obedient
Byram [Beheram]

Please write letter

dt 31/ December 1929
765 Butler Molha camp. Poona.

Memo

પુજ્ય પવિત્ર શ્રી બાબા,

જન શાજ તમારો કાર હાલમાં પણ, મારા બા
દરૂન તખાલ્લુ અને સરદી ઠાસો ફેરાન કરા રહ્યાય.
તે હતા બાબા તૈયારી કરા ગઈ કાલે રાત્રે હું તમો
તરફ દિશી આપનાર હતો, પરંતુ સાંજ પછી તખાલ્લુ
પછી બગડવાથી અને અવરુદ્ધ ફેરાથી ફાં ત્યાં આપનાર
મો ફુફ ફાધુ, અને આપને તોજા આપના તમાને તકાલુ
અને ફેરાન ગતી થતે, શ્રી બાબા, હું તમો તરફ રહી
તમાને મારા આપુ બા દરૂન તખાલ્લુ તકાલુ અને
ફેરાન ગતી થાય તે કરતા હું અશી, અપમાનને ઠીકાઈ
રહી છોતે ફેરાન આપુ કે પાંચુ પસંદ કરું છું!

હું આરુદ્ધ તેમ કોડે બાબુ ઠીક પડ્યા મારા અસાધ્ય
બધા! અને શાજ ફેરાન પખાલ આપુ તકાલુ તખાલ્લુ
(અને મારા ખુરા અંતરફાર) ફેરાન કરા રહ્યાય.

ગઈ કાલથી ફોર્ડ એન પડ્યું બધા. અસાધ્ય તમો
મારા પર. ગુસ્સો તોજા બારાજ ફરતોજ, પરંતુ
શ્રી બાબા! તમો બધું બાલો છો' અને બાકાર કરા
કાલો દાલો સંતાલ મેળપા પચાન કરૂં છું.

ફાં હું ઠી. મરુદ્ધ બા Prescription બા હા મરૂં છું.

મુજ બરાબરે મારૂં ફરવો તોજા મરૂં ફેરાન કરા રાખતા
રહેવો. જરૂર ફેરાન તખાલ્લુ મને બારજ આપવા રાશે.
સાતરંગ વાસ્તફાર!

ભા. તમારો સદાજો ભાખેદાર.

બેરામ

પચાતો!! શાજ રોજે ડાક્ટર આપના કોડે બંજેકરના મુકાબા
આપો અને તેના

Dt 31-December 1929
765, Butler Mohalla Camp Poona.

Respected and Pure Shri Baba,

Since the last 3-4 days, again my health is not good and a cold and cough are harassing me. In spite of that ,I made all the arrangements and was ready to leave last night to come to you, but late in the evening, my health worsened and because of weakness I postponed coming for the present. And albeit even if I came, you would have been put to trouble and harassment. Shri Baba, when I stay with you, you are troubled and harassed by my constant poor health and other matters. I would prefer to stay home or some other place and allow only myself to be troubled instead!

I feel that it is not in my destiny to become settled in one place! And for quite some time my failing health (due to my bad sanskaras) is troubling me. Since yesterday I am feeling restless. Albeit, you must be angry and disappointed with me but Shri Baba! I am trying to get some consolation from the thought that you know everything.

At present I am taking the medicine as per Dr. Bharucha's prescription.

Please forgive my poor self and continue to keep your compassionate Nazar on me. Do write and give me solace.

Sakstang Namaskar [Salutations in prostration at your feet]

Your ever obedient

Byram [Beheram]

Today I went to the Doctor and got an injection and for that

Khudawand [Zoroastrian praise of God] Shree Meherbaba

Brother Baily has informed me that he got a letter from you, and your large-hearted soul has granted pardon! On hearing this my heart jumped for joy.

Shri Baba! At present my health is not at all well and I had written to you earlier and you had not replied. And your ten rupees are in my drawer so what shall I do? Or shall I send them? This is what I had asked you. So please send your reply. Kindly write a separate letter to me.

Your ever-obedient S
Byram[Beheram]

NB: definitely write to this poor one.

Mand

Khudawand Shree Meher Baba

om namo bhagavate

સ્વસ્તિ આત્મા આત્મા આત્મા
આત્મા આત્મા આત્મા, ને આત્મા આત્મા
આત્મા આત્મા આત્મા ને આત્મા
આત્મા આત્મા, ને આત્મા આત્મા આત્મા
આત્મા આત્મા. આત્મા આત્મા આત્મા
આત્મા,

આત્મા આત્મા આત્મા આત્મા આત્મા
આત્મા આત્મા આત્મા આત્મા આત્મા
આત્મા આત્મા આત્મા આત્મા આત્મા

આત્મા આત્મા આત્મા આત્મા આત્મા
આત્મા આત્મા.

M. આત્મા આત્મા આત્મા આત્મા. S.

Bye

Khudawand [Zoroastrian praise of God] Shree Meher Baba

Mother and sister Mani have arrived in Poona safe and sound. At present my health is all right. And Mother said that your health is not good and I felt sad to hear this. So please write me about your health. At present there is nothing to write.

Good wishes to all the Mandali and you please accept the prostrations of this poor self.

Please continue to keep your kind grace on my poor self.

Your ever-obedient S
Byram [Beheram]

Hand

પુત્ર પુત્રી ની બાબત.

જન. નરુ દલાસે ને ની ની ના રીગર
નરુ રુ ને નરુ પુરુ રી.

બાળ - મીરુ મીરુ સિ. બાળમીરુ ની ની ની
રુ ની ની. રુ મીરુ મીરુ રુ રુ ની રુ રુ
નરુ - બાળ મીરુ ની ની - ને રુ મીરુ રુ રુ
નરુ મીરુ રુ ને ને ની ની ની ની રુ ની ની.

બાળ મીરુ બાળ ની રુ રુ-રુ રુ રુ ની રુ
સિ. રુ રુ ની ની રુ રુ ની રુ. ની રુ ની
રુ રુ રુ રુ ની રુ ની પીરુ રુ રુ ની રુ રુ.

— ~~રુ~~ ને રુ રુ રુ રુ રુ રુ.

રુ રુ રુ રુ રુ ની ની રુ રુ રુ રુ
રુ રુ, ને *Reps palpitation* ની *irregular* રુ.

રુ રુ ની રુ રુ રુ રુ રુ રુ ! ને
રુ રુ રુ રુ રુ રુ રુ રુ !

રુ રુ રુ રુ રુ રુ !

ન. ની રુ રુ રુ ની રુ રુ રુ.

નરુ

Respected and Pure Shri Baba,

I had written a letter to you, Shri, day before yesterday. It must have reached you.

Secondly, my going to Bombay to see Dr. Billimoria has not worked out yet. I would have gone alone to Bombay for one day but because of another problem - I have no information as to whether the doctor is in Bombay or in another place - I am still waiting. Secondly, news has come that in 15-20 days time, he is coming here to Dr. Koyajee. In the meantime I am thinking of taking the medicine which he had prescribed for me earlier - if that works, I can see him soon.

Last night again I had a lot of pain in my chest and irregular palpitations. Please continue to keep your compassionate Nazar on my poor self! And if I make any mistakes, please forgive me!

Sakstang Namaskar!! [Salutations in prostration at your feet]

Your ever-obedient

Byram [Beheram]